

000000

અનાજો જેવાકે ઘઉં, બજથે, જુવાર, Malt કથી શકાય. નાચી સામન્ય થીતેભથ્લા દક ધણિ ભગમં ખાવામં આવે છે. બીજા અનાજો જેવા કે ચેખા, ચેખાના flakes, મ્કાઈના flakes, તેને પણ શેકી અને ભુકો કથીને કાંજીના રૂપમં પણ આપી શકાય છે. ડાળો જેવી કે મ્કા (પુથ) Malt કથી શકાય છે, કાથાકે તેપચ્વામં સથા હોય છે. શેકેલી અને ભુકો કો કચેલી મ્કાની ડાળ પણ કાંજીમં વપથય છે.

Nuts

શેકેલા અને જમીનના શગિદાણા (૧ અચી) બળકને તેલ મ્કાનિના થય ત્યાચે આપી શકાય છે. શાકભજી : ઉકાળેલા અને છુંદેલા પોચ શાકભજી કાંજીમં ખેાવી શકાય છે. દા.ત ટમેટા, કોળુ, પાલક અને બીજા લીલા પાંદડાવાળા શાકભજી.

0000

કઠણ થંદેલા ઇંડાનો પીળો ભગ પણ જુદીજુદી જાતની કાંજીમં ખેાવી શકાય છે.

- દુધનો પાવડર (૨ અચી) કાંજીમં ખેાવી શકાય છે, જો તેપાણીમંથી બ્લવત્યો હોય.
- થેડી ખાંડ અને તેલ/મખણ (૧ અચી) તેની કેલથી વધથવા મટે કાંજીમં ઉમેથી શકાય છે.

0000000000 0000 00000000000000 00000000 00000000 00000000000 00000000.

દુધમં અથવા પાણીમં થેડી મનિટિ બ્ધ મશિ થોના ઘટકો ઉમેથીને અને થંદીને અથ ધી કઠણ/છુંદેલી સ થથિત ખેાવવા મટે.

કાંજી	
બજથે - ૨ અચી	
ચખાની દાળ - ૨ અચી,	ચેખા(પોહા)ની કાંજી
ચેખાના flakes(પોહા)નો લોટ - ૨ અચી.	
ફળની કાંજી	
થ્વો - ૨ અચી	
તેમં થંદેલુ કેળુ અથવા ફળ ઉમેથી.	સફથજનની કાંજી
ચેખા - ૨ અચી	
૧/૨ ઉકાળેલુ સફથજન	
શાકભજીની કાંજી	
બજથે - ૨ અચી	
શગિદાણા - ૧ અચી	
મ્સુથ/ત્ણા - ૧ અચી	
ગાજથ/શાકભજી - ૨ અચી	ટમેટાની કાંજી
બજથે - ૨ અચી	
ચેખાનો પાવડર - ૨ અચી	
શગિદાણા - ૧ અચી	
ત્ણ દાળ - ૧ અચી	
ટમેટા (ઉકાળેલા) - ૧ અચી.	
શાકભજીના પથઠા	
બજથે - ૨ અચી	
શગિદાણા - ૨ અચી	
મ્સુથ/ત્ણા/ચખા - ૧ અચી	
બ્ટેટા (ઉકાળેલા) - ૨ અચી	
તેલ - ૧ અચી.	

બ્ધ મશિ થો ભેગા કથીને લોટ બ્લાવો અને પથઠાને બ્દલે અનાજ ઘઉં, જુવાર અને નાચી સાથેશેકો. બ્ટેટાને બ્દલે પાલક અને બીજી શાકભજી થખો.